



**SURAT MUNICIPAL CORPORATION
SOUTH ZONE - A(UDHANA)**

TECHNICAL: VOLUME - I

**NAME OF WORK : Trimming of Avenue Trees as and when Required in Area of
South Zone-A(Udhana), Surat.(6th Attempt)**

ON LINE TENDER NOTICE No. DMC/SZ-A/03/2026-27.

Work No.: 07

**PERIOD OF DOWNLOADING
OF TENDER FROM : 19/06/2026 TO 09/07/2026 UP TO 18.00 Hrs**

ONLINE SUBMISSION DATE : UP TO 09/07/2026 UP TO 18.00 Hrs

**SUBMISSION OF TENDER FEE,
EMD (IN HARD COPY) ETC. BY
R.P.A.D. / SPEED POST ONLY :UP TO 18/07/2026 UP TO 18.00 Hrs**

ESTIMATED AMOUNT : Rs. --

EARNEST MONEY DEPOSIT : Rs. 10,000.00

TENDER FEE : Rs. 1,062.00

**2025 – 2026
To be submitted at,
Chief Accountant,
Surat Municipal Corporation.
Tapipura,
Surat – 395 003.**

ટેન્ડર આપનાર માટે અગત્યની સુચના

(૧)



સહી નો નમૂનો

(૨)

જો પાર્ટનરશીપ હોય તો દરેક પાર્ટનરના પાસપોર્ટ સાઈઝના ફોટા અહીં ચોટાડવા.

દરેક પાર્ટનર (પાર્ટનરશીપ હોય તો) ની સહીના નમુના.

૧)

પાર્ટનરશીપ હોય તો રજી. કરારનામાની નકલ
અવશ્ય આપવી.

૨)

૩)

૪)

(૧) ઈજારદાર / એજન્સીનું નામ :-

(૨) સરનામું :-

(૩) તારીખ. / / ૨૦૨૬

સુરત મહાનગરપાલિકા
જાહેર બાગબગીચા ખાતુ

ON LINE TENDER NOTICE No. DMC/SZ-A/03/2026-27.

ટેન્ડર ભરવા અંગેની વિગત :-

As per City Engineer Shri Note No. 61, Dt. 05/02/2025

1.1. Demand Draft for E.M.D. & Tender (Bid) fee shall be submitted in electronic format through online mode (by scanning) while uploading the bid. This submission shall mean that E.M.D. & tender fee are received for purpose of opening of the bid. Accordingly, offer of those shall be opened whose E.M.D. & tender (bid) fee is received electronically. However, for the purpose of realization of D.D. bidder shall send the D.D. in original through RPAID / Speed post as per to reach to Chief Accountant, SMC within 7 days from the last date of online submission of the bid as per tender notice.

Penaltative action will be taken for not submitting original Demand Draft in the account department of Surat Municipal Corporation within 7 days from the last date of online submission of the bid for the first time as mentioned below.

Sr. No.	Tender Amount	Penalty Amount in Rs.
1.	Up to Rs. 1 Crore	Rs. 10,000/-
2.	More than Rs. 1 Crore and Upto Rs. 10 Crore	Rs. 20,000/-
3.	More than Rs. 10 Crore and Upto Rs. 50 Crore	Rs. 30,000/-
4.	More than Rs. 50 Crore and Upto Rs. 100 Crore	Rs. 70,000/-
5.	More than Rs. 100 Crore	Rs. 1,00,000/-

If bidder will not submit the penalty amount within 10 days to Surat Municipal Corporation and/or bidder will not submit the demand draft in original for the second time and after, Penaltative action shall be taken for abeyance of registration and cancellation of E-tendering code for 6 (six) months.

Any documents in supporting of bid shall be in electronic format only through online (by scanning) & hard copy will not be accepted separately.

Following enhancement factors will be used for the cost of works executed and financial figures to amount base for the value of the works completed in India.

Cut of month shall be considered from month of tender submission.

Financial Year	Multiplying factor
Immediate last year of the assessment year	1.10
Second	1.21
Third	1.33
Fourth	1.46
Fifth	1.61
Sixth	1.77
Seventh	1.95

Here assessment year shall be reckoned from year and month in which tender is submitted.

Bidder should indicate actual figures of cost and the amount for the work executed in Statement-A without accounting for the above mentioned factors.

- ઈ.એમ.ડી. ની રકમનો કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ.
- ટેન્ડર ફી કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ.
- ટેન્ડર એમાઉન્ટની ૨૦ % રકમનું રાષ્ટ્રીયકૃત બેંકનું પ્રમાણિત કરેલ સોલ્વન્સી સર્ટીફિકેટ (રૂ.૨.૦૦ લાખ થી વધુ)
- આ પ્રકારના કામના અનુભવની પ્રમાણિત નકલ
- પાન કાર્ડની પ્રમાણિત નકલ.
- Non Blacklist Contractor (To be given on the authorized amount of stamp paper approved by Government of Gujarat with Applicable Article signed by authorized notary)

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઝોન-એ(ઉદના)

ઈજારદારની સહી.

ઈજારદારનું નામ તથા સરનામું

સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન-એ (ઉધના)

સામાન્ય શરતો:—

૧. આ પ્રકારના કામના અનુભવી ઈજારદાર પોતાની સંસ્થાના લેટર પેડ પર અનુભવના પ્રમાણપત્ર સાથે ટેન્ડર ભરી સુરત મહાનગરપાલિકાના હીસાબી ખાતામાં મોકલવાનું રહેશે.
૨. ભરેલા ટેન્ડર સાથે રૂ. ૧૦,૦૦૦.૦૦ પૈ. ઈ.એમ.ડી. તરીકે બેંક ડ્રાફ્ટ અથવા રોકડ રકમ કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના નામ પર મુકવાની રહેશે.
૩. ઈજારદારને ઈજારો મળ્યા અંગેનો પત્ર મળ્યેથી દિન-૧૦ માં ઈજારો આપવામાં આવેલ મુદતમાં થતી કુલ રકમના ૨% લેખે થતા રોકડ નાણાં અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકામાં જમા કરાવી આ માટે જરૂરી કરારનામું કરવાનું રહેશે.
૪. ટેન્ડરની શરતોની નકલ પર સહી કરવાની રહેશે. ટેન્ડરની શરતો બીનશરતી સ્વીકાર્ય હોયતો જ ભાગ લઈ શકાશે.
૫. ટેન્ડર કોપી સાથે અત્રેથી ઈસ્યુ કરવામાં આવેલ તમામ ટેન્ડર ડોક્યુમેન્ટસ, કામ અંગેનું ભાવપત્રક/ ફોર્મ તથા કામની વિગતો અને મુખ્ય શરતો તથા જનરલ સુચના તેમજ અન્ય તમામ કાગળો પર સહી — સિકકા કરી આપી ઓફર સાથે પરત આપવાના છે. તેમ કરવામાં નહીં આવશે તો ટેન્ડર રદબાતલ ગણવામાં આવશે.
૬. ઈજારદારના ભાવોની વેલીડિટી ટેકનીલક બીડ ખોલવાની તારીખથી દિન — ૧૨૦ રહેશે.
૭. આ કામ અંગેનું ટેન્ડર મંજૂર થયેથી ટેન્ડર ધ્વારા નીચે જણાવેલ વિગતે ગુજરાત રાજ્યના નોન-જયુડીશીયલ સ્ટેમ્પ પેપર ઉપર સ્વખર્ચે કરારનામા કરી આપવાના રહેશે.
(અ) ઉપરોક્ત સિવાય અન્ય કોઈ સ્વરૂપમાં સીક્યુરીટી ડીપોઝીટની રકમ સુરત મહાનગરપાલિકામાં જમા કરાવવાના કિસ્સામાં રૂ. ૩૦૦/-ના મૂલ્યવાળા કુલ-૦૩ સ્ટેમ્પ પેપર ખરીદી, તેના પર કરારનામા કરી આપવાના રહેશે.
(બ) આ કરારનામા મુખ્યત્વે ત્રણ ભાગમાં કરી આપવાના રહેશે.
(i) Contract Agreement
(ii) Surety
(iii) Undertaking
૮. **કવોલીફિકેશનની શરત : —**
(1a) Average Annual financial turnover during the last 3 year, i.e. 01/04/23 to 31/03/26 Should be at least **Rs.1,50,000.00.**
(1b) Experience of having successfully completed similar works as tender condition during last 7 year ending last Day of month previous to the one in Which applications are invited should be either of the Following.
a) Three similar completed works costing not less than the amount equal to **Rs.2,00,000.00** (40% of estimated cost).

OR

- b) Two similar completed works costing not less than the amount equal to **Rs.2,50,000.00** (50% of estimated cost).

OR

- c) One similar completed work costing not less than the amount equal to **Rs.4,00,000.00** (80% of estimated cost).

(1c) similar works defines as Cutting down trees and carrying wood / Wood disposal operation / horticultural development and maintenance works in gardens /dividers / horticultural maintenance works with supplying of manpower and vehicle.

૯. ઈજારદારની સીક્યુરીટી ડીપોઝીટની રકમ સુરત મહાનગરપાલિકા ધ્વારા ઈજારદારને પરત ન કરતા, જમા ખાતે રાખવામાં આવશે. ઈજારદાર ધ્વારા જમા કરાવવામાં આવેલ સીક્યુરીટી ડીપોઝીટની કુલ રકમ તેઓનો ઈજારો પૂર્ણ થયેથી વસુલાતની રકમ (જો કોઈ હોય તો) બાદ કરી, બાકી રકમ પરત કરવામાં આવશે.
૧૦. જો ઈજારદાર ધ્વારા સંચાલનની કામગીરી સંતોષકારક નહીં જણાશે તો તેવા કિસ્સામાં ઈજારદારને વધુમાં વધુ ૩(ત્રણ) નોટીસ પાઠવવામાં આવશે. તેમ છતાં પણ કામગીરીમાં સુધારો ન થાય તો તેવા સંજોગોમાં ઈજારદારનો ઈજારો રદ કરી, સીક્યુરીટી ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
૧૧. ટેન્ડર કામ અંગેની તમામ માહિતીઓ અને વિગતો જાણી, કામગીરીઓ, વિગતો, શરતો, વિ. ની નોંધ લઈ તેને આધીન અને જે તમામ કબુલ મંજૂર અને બંધનકર્તા રહેશે. જે ધ્યાનમાં લઈ ઈજારદારે સદર ટેન્ડર / ભાવપત્રક ભરવાનું રહેશે.
૧૨. કરારના સંદર્ભમાં જે કોઈ વિવાદ ઉત્પન્ન થાય તે માટે સુરતની કોર્ટની હકુમતને આધીન રહેશે.
૧૩. કોઈ પણ ટેન્ડર સ્વીકારવા અથવા કોઈપણ અથવા તમામ ટેન્ડરો નકારવા અથવા એકથી વધુ ટેન્ડર ભરનારાઓ વચ્ચે ઓર્ડરની વહેંચણી કરવાનો સર્વ હકક મહાનગરપાલિકાને અબાધિત રહેશે. જે અંગે કોઈપણ કારણ આપવામાં આવશે નહીં.
૧૪. ટેન્ડર સ્વીકારવાની આખર તારીખના કામકાજના બીજા દિવસે અનુકુળતા હશે તો અથવા અન્ય અનુકુળ દિવસે અને સમયે હાજર રહેલ ઈજારદારોની રૂબરૂમાં ટેન્ડરો ખોલવામાં આવશે.
૧૫. આ શરતો ઉપરાંત કોઈપણ પ્રકારની તાંત્રિક, કાયદાકીય ગુંચ કે અન્ય બાબતો માટે સુરત મહાનગરપાલિકાના કામો માટે પ્રણાલિગત શરતો લાગુ પડશે. જે ઈજારદારને માન્ય રાખવાની રહેશે.
૧૬. ઈજારદાર વખતો – વખત લેબર – લો, સે. ટેક્સ, સર્વિસ ટેક્સ વિગેરે તથા જે તે સમયે ટેન્ડર કામને લાગુ પડતા વેરાઓ (જીએસટી) અને અન્ય કાયદાઓની અમલવારી માટે જવાબદાર રહેશે.
૧૭. જો કોઈ સંજોગોમાં કોન્ટ્રાક્ટરમાં આપેલ મશીનરીથી અથવા કોન્ટ્રાક્ટના મશીનરીને અકસ્માત થાય તો તેવા સંજોગોમાં મશીનરીની નુકશાની કે મશીનરીમાં બેઠેલા કે અન્ય ઇસમોને થયેલ ઈજાઓ કે અવસાન કે અન્ય નુકશાનીઓ અંગેની તમામ જવાબદારી મશીનરીના ચાલક તથા મશીનરીના માલીકની સાથે – સાથે કોન્ટ્રાક્ટની રૂએ કોન્ટ્રાક્ટ એજન્સીની રહેશે. જે અંગે મશીનરીના માલીકે અલગથી સંમતિ/ કરારનામું કરી આપવાનું રહેશે. મહાનગરપાલિકાએ આ અંગે કોઈ જવાબદારી સ્વીકરેલ નથી અને રહેશે નહીં.
૧૮. ઈજારદારે ફાળવેલ વાહનમાં જે કઈ મટીરીઅલ ભરવામાં કે ખાલી કરવામાં આવે તે પોતાના મજૂરો દ્વારા કરવાનું રહેશે. જેની અલગથી કોઈ મજૂરીની રકમ ઈજારદારને ચુકવવામાં આવશે નહીં.

૧૯. સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ નિતિ-નિયમ પ્રોસીજર વિગેરેમાં વખતો — વખત ફેરફાર થાય તો તે ઇજારદારને બંધનકર્તા રહેશે.
૨૦. ઇજારદારે તેમને ફાળવેલ વાહનોમાં પ્રતિબંધિત માલસામાનની હેરફેર કરી શકશે નહીં.
૨૧. જો કોન્ટ્રાક્ટરની કામગીરી મહાનગરપાલિકાને સંતોષકારક જણાશે નહીં તો કોઈપણ પ્રકારના કારણો આપ્યા સીવાય, નોટીસ આપ્યા સીવાય અધિકૃત અધિકારી કોન્ટ્રાક્ટર રદ કરી શકશે.
૨૨. જો ઇજારદારે પોતાના કોન્ટ્રાક્ટ રદ કરવો હોય, તેવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરે ૩૦ દિવસ અગાઉથી નોટીસ આપવાની રહેશે.
૨૩. જો કોઈ કિસ્સામાં વિવાદ ઉપસ્થિત થાય તો તેવા કિસ્સામાં સંબંધિત વિભાગીય વડા અથવા મ્યુ. કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને કોન્ટ્રાક્ટરને બંધનકર્તા રહેશે.
૨૪. કોન્ટ્રાક્ટર ચાલુ હોય તે દરમિયાન મહાનગરપાલિકા સદરહું કોન્ટ્રાક્ટ બાબતે કોઈ નિતિ નિયમ નક્કી કરે અથવા વધારાની શરત સામેલ કરેલ તો તે ઇજારદારે બંધનકર્તા રહેશે. આ ફેરફારની ઇજારદારને લેખીત જાણ કરવામાં આવશે.
૨૫. આ કામના ઇજારાનો સમયગાળો ૦૬ (છ) વર્ષનો રહેશે.
૨૬. ઇજારદારે કોન્ટ્રાક્ટ ધારા મુજબની કોઈ શરતો રજુ કરે તો તે મહાનગરપાલિકાને તે મુજબ કરવાની ફરજ પાડી શકશે નહીં અને તે શરતો મહાનગરપાલિકાને બંધનકર્તા રહેશે નહીં.
૨૭. કોન્ટ્રાક્ટ (મજૂર નિયમન અને નાબુદી) અધિનિયમ — ૧૯૭૦ પ્રવર્તમાન કાયદા હેઠળ લાયસન્સ લેવું જરૂરી હોય તે અંગે જરૂરી લાયસન્સ મેળવવાનું રહેશે.
૨૮. કોન્ટ્રાક્ટરો આ રોજીદા અને અનિવાર્ય કામગીરી મનસ્વીપણે એક તરફી રીતે બંધ કરશે તો સક્ષમ સત્તાની મંજૂરીની આધિન કોન્ટ્રાક્ટરની સીકયોરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે અને નોટીસ પીરીયડ જેટલા દિવસો માટે મહાનગરપાલિકા અન્ય ઇજારદાર પાસે કામ કરાવે તો તે અન્ય ઇજારદારને સદર કામ અંગેના મંજૂર થયેલા દરો કરતા વધુ જે રકમ ચુકવવી. અન્ય ચુકવવાની થાય તેટલી રકમ નિષ્ફળ ગયેલા ઇજારદાર પાસેથી તેઓના બીલ/ ડીપોઝીટ/ અન્ય કામો માંથી નિકળતી લેણી રકમ માંથી વસુલ કરવામાં આવશે.
૨૯. કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર મળ્યા બાદ દિન — ૧૦ માં કામ ચાલુ કરવાનું રહેશે. જો તેમ કરવામાં કોન્ટ્રાક્ટર કસુર કરશે તો તેની ઉપર નિયમોનુસાર પેનલ્ટી વસુલ લેવામાં આવશે.
૩૦. મજૂર/ કામદારોને સરકારી કાયદાઓ મુજબ મીનીમમ વેજીસ એક્ટ મુજબ પગાર ઇજારદારે ચુકવવાનો રહેશે અને તેની સઘળી જવાબદારી ઇજારદારની રહેશે.
૩૧. શરતોના અર્થે અને અમલ અંગે ટેન્ડર મંજૂર કરવા કે નહીં તે અંગેનો સર્વ હકક સુ.મ.પા., સુરતનો નિર્ણય છેવટનો રહેશે અને તે માટે કોઈપણ કારણો આપવામાં આવશે નહીં.

કાર્યપાલક ઇજનેર
સાઉથ ઝોન-એ(ઉધના)

ઉપરોક્ત શરતો અમને માન્ય અને બંધનકર્તા છે

ઇજારદારની સહી.

સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન-એ(ઉધના)

ખાસ શરતો:—

૧. ઈજારદારે અનુભવી કામદારો રાખી વૃક્ષોનું ટ્રીમીંગ કામ કરવાનું રહેશે.
૨. ઈજારદારે જે તે સ્થળે સુચવેલ વૃક્ષોનું ટ્રીમીંગ સંબંધિત સુપરવાઈઝર(ગાર્ડન/હોર્ટી.)ના માર્ગદર્શન હેઠળ કરવાનું રહેશે.
૩. વૃક્ષોનું સંતુલીત ટ્રીમીંગ હલકી/ મધ્યમ/ ભારે પ્રકારની સ્થળ સ્થિતિ મુજબ કરવાની રહેશે.
૪. વૃક્ષ ટ્રીમીંગની કામગીરી દરમિયાન કાપેલ ડાળી/ડાળખા, લાકડા તેમજ પાલાનો જે તે ઝોનમાં સુચવેલ સ્થળે નિકાલ કરવાનો રહેશે.
૫. ઈજારદારે કામગીરી નિયત સમયમાં પુર્ણ કરી સંબંધિત સુપરવાઈઝર(ગાર્ડન/હોર્ટી.)ને જાણ કરવાની રહેશે.
૬. વૃક્ષ ટ્રીમીંગ કામગીરી દરમિયાન કામદારો/ રાહદારીઓ/ વાહનોને કોઈપણ જાતની ઈજા/ નુકસાન થાય તો તેની સંપુર્ણ જવાબદારી ઈજારદારની રહેશે.
૭. ઈજારદારે વૃક્ષ ટ્રીમીંગની કામગીરી માટે જરૂરી સાધન/ સામગ્રી જેવી કે, કુહાડો, કુહાડી, દોરડા વિગેરે રાખવાના રહેશે.
૮. ડાળી/ડાળખા તેમજ પાલાના નિકાલ માટે ટ્રેક્ટર વીથ હાઈડ્રોલીક ટ્રેઈલર અથવા ટેમ્પો રાખવાનો રહેશે.
૯. રોડ સાઈડ કપોક સિવાયના વૃક્ષના હેવી ટ્રીમીંગ કરવામાં આવે તો તેના લાકડા જે તે ઝોનમાં સુચવેલ સ્થળે જમા કરાવવાના રહેશે.
૧૦. વૃક્ષ ટ્રીમીંગની કામગીરી ટ્રાફિકમાં અવરોધ ઉભો ન કરે તે રીતે કરવાની રહેશે.
૧૧. ઈજારદારે વૃક્ષ ટ્રીમીંગ કરવાનો ભાવ તમામ લાગુ પડતા વેરાઓ (જીએસટી) સહિતનો આપવાનો રહેશે.
૧૨. સદર કામગીરી માટે સાઉથ ઝોન-એ(ઉધના) ગાર્ડન વિભાગના આસી.ઈજનેર તથા હોર્ટી.સુપરવાઈઝરનો સંપર્ક કરવાનો રહેશે.
૧૩. તકરારી બાબતે સુરત કોર્ટને આધિન સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અધિકૃત રહેશે.
૧૪. ઉપરોક્ત શરતોમાં ફેરફાર કરવાનો સર્વ હકક સુરત મહાનગરપાલિકાને અબાધિત રહેશે.

કાર્યપાલક ઈજનેર
સાઉથ ઝોન-એ(ઉધના)

ઉપરોક્ત શરતો અમને માન્ય અને બંધનકર્તા છે.

ઈજારદારની સહી

MEMORANDUM

Note:-

1. In the event of the deposit being made in the form of Government Papers etc. the value of the Public Securities to be lodged as Contract Deposit will be calculated at 2% less than their Market Value on the day of acceptance.
2. The tenders will be received from upto **18/07/2026** up to 18:00 hrs. by R.P.A.D./Speed Post only and will be opened at 16.00 hrs. on next day if possible in the presence of those tenders who choose to remain present on the occasion.

1. General Description of work :- **Trimming of Avenue Trees as and when Required in Area of South Zone-A(Udhana), Surat.(6th Attempt)**
2. Estimated Cost :- **Rs. --.**
3. Earnest Money Deposit :- **Rs. 10,000.00**
4. Security Deposit :- **2.00 % (Two percent)**
5. Time allowed for the completion of Work from date fixed in written order to Commence :- **12 (Twelve) Months**
6. Compensation for delayed work under Clause 2.....:- **0.2%(Zero point Two percent) of the Tender value of whole work per day.**
7. The progress of work should Confirm to the following schedule :- **day to day routine horticulture work**
8. Percentage to be retained from Running Account Bills..... :- **7 % (Seven Percent)**
9. Defect Liability Period :- **N/A.**
10. Amount of water charges :- **N/A.**
11. Deduction :- **GST and all other taxes/ charges as per prevailing terms & conditions to be borne by contractor.**

Executive Engineer
South Zone-A(Udhana)
Surat Municipal Corporation

SIGNATURE OF THE CONTRACTOR
ADDRESS:
DATE:

એડવાન્સ સ્ટેમ્પ રીસીપ્ટ

મેં / અમોએ, ટેન્ડર સાથે ભરેલ અર્નેસ્ટ મની ડીપોઝીટની રકમ રૂ.
.....(અંકે રૂપિયા પુરા) સુરત મહાનગરપાલિકા ની
રીસીપ્ટ નં..... તા.થી આભાર સહીત પરત મળેલ છે.

તા. / /૨૦૨૬

રેવન્યુ સ્ટેમ્પ

ઈજારદારનું નામ અને સરનામું :—